

## સસ્તા ભાવે સોનું વેચવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર ટોળકીનો મુખ્ય સુત્રધાર

### ઇસમને ઝડપી પાડતી સુરત શહેર કાઇમ બ્રાંચ.

સુરત શહેર પીપલોદ રાહુલરાજ મોલ પાસેથી લોકોને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી મોટી રકમની છેતરપિંડી કરતી ગેંગના કુલ-૧૧ ઇસમોને ઝડપી પાડી તેઓ વિરૂધ્ધ ડી.સી.બી. પો.સ્ટે. 1 ગુ.ર.નં.૧૧/૨૦૧૯ ઈ.પી.કો. કલમ-૪૦૬, ૪૨૦, ૫૧૧, ૧૧૪ મુજબનો ગુનો નોંધવામાં આવેલ. જે ૧૧ આરોપીઓની પુછપરછમાં તેઓના મુખ્ય સુત્રધાર તરીકે આરોપી-વિશાલ જૈન ઉર્ફે મનોજ તથા તેનો મોબાઇલ નંબર મળી આવેલ. જે મોબાઇલના લોકેશન આધારે આરોપીની તપાસ કરવા કાઇમ બ્રાંચની એક ટીમ રાંચી ઝારખંડ ખાતે તપાસમાં મોકલવામાં આવેલ અને તેઓને રાંચી ઝારખંડ ખાતેથી એક ઇસમ નામે-મનોજકુમાર ઉર્ફે વિનાયક અગ્રવાલ ઉર્ફે વિજય ગુપ્તા ઉર્ફે છોટ્ટુ S/O રામપ્રસાદ ઠાકુર (નાઇ) ઉ.વ.૩૫ રહે-ફ્લેટ નં-૧૦૪, ઘરોંદા એપાર્ટમેન્ટ, ડાંગરાટોલી ચોક, થાના-લુવર રાંચી, તા-જી-રાંચી (ઝારખંડ). મુળ વતન ગામ-બરૌની કુલભરીયા બજાર, પોસ્ટ-ગૌરા તા-ગૌરા જી-બેગુસરાય (બિહાર) નાને શંકાના આધારે ઝડપી લઇ તેની પાસેથી શંકાસ્પદ ATM કાર્ડ તથા ડેબીટ કાર્ડ નંગ-૧૫ તથા જુદી જુદી બેંકોની પાસબુક નંગ-૮ તથા ચેકબુક નંગ-૧૬ તથા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૧૩ કિં.રૂ-૭,૦૦૦/- તથા ટેબલેટ નંગ-૨ કિં.રૂ-૨,૫૦૦/- તથા લેપટોપ નંગ-૨ કિં.રૂ-૧૫,૦૦૦/- તથા સીમકાર્ડ નંગ-૩ જેવી કુલ રૂ-૨૪,૫૦૦/- ના મત્તાની ચીજવસ્તુઓ મળી આવતા સદરી ઇસમને આ ગુનાના કામે પુછપરછમાં પોતે ઇન્ડીયા માર્ટ નામની વેબસાઇટ ઉપર રજીસ્ટર થયેલ નાના-મોટા સોનાના વેપારીઓનો સંપર્ક કરી સસ્તામાં સોનું આપવાની લાલચ આપી તેઓને સુરત તથા મુંબઇ ખાતે કોઇ જાહેર જગ્યા પર બોલાવી તેઓને પકડાયેલ પોતાના મળતીયા ઇસમોનો પરિચય કેશ મેનેજર, ગોલ્ડ એક્ષપર્ટ વિગેરે મુજબનો આપી, તેઓને મોટા વેપારી હોવા અંગે પ્રભાવિત કરી, તેઓની સાથે એક કિલો ગ્રામ સોના ઉપર મોટું ડિસ્કાઉન્ટ આપવાની લાલચ આપી તેઓને સેમ્પલ તરીકે ૧૦૦ ગ્રામ સોનાનું બિસ્કીટ આપી તેની ચકાસણી કરવા માટે મોકલી આપી તેઓ પાસે સોનું ખરીદવા લાવેલી રકમ છેતરપીંડીથી મેળવી લેતા અને પોતાના મળતીયાઓ મારફત પોતે નક્કી કરેલ ટકાવારી મુજબની રકમ વહેંચી લેતા હોવાની કબુલાત કરેલ છે.